

# દુઆએ અદીલહ

- : પ્રકાશક : -

હાજી નાજી મેમોરીયલ ટ્રસ્ટ

માળી ટેકરા, આંબાચોક, ભાવનગર

ફોનનંબર : (૦૨૭૮) ૨૫૧૦૦૫૬ / ૨૪૨૩૭૪૬

... Kitab Downloaded from ...

[www.hajinaji.com](http://www.hajinaji.com)

● **LIKE US ON FACEBOOK** ●

[www.facebook.com/HajiNajiTrust](http://www.facebook.com/HajiNajiTrust)

# નોંધ.....

→ વધુ કિતાબો ડાઉનલોડ કરવા માટે [www.hajinaji.com](http://www.hajinaji.com) પર લોગ ઓન કરો.

→ કિતાબમાં કોઈ ભૂલચૂક જણાય તો પેજની વિગત અને કિતાબનું નામ જાણ કરવા વિનંતી.

[hajinajitrust@gmail.com](mailto:hajinajitrust@gmail.com)

# દુઆએ અદીલહ

શયતાનની જાતમાં એક “અદીલહ” નામનો દેવ છે, જ્યારે ઇન્સાનનો સકરાતનો સમય થાય છે ત્યારે ઇમાનને બરબાદ કરવા માટે તે વસવસો નાખે છે, તો તેના વસવસાથી બચીને ઇમાન સલામત રાખવા માટે હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)એ ફરમાવેલ છે કે જે કોઈ સુબ્હની નમાઝ પછી આ “દુઆએ અદીલહ” પઢે, તો ઇમાનદારીની હાલતમાં દુનિયાથી જાય અને

સકરાતની હાલતમાં કોઈ શખ્સ આ દુઆ પઢે  
તો તેની રૂહ આસાનીથી નીકળે.

હકથી ફરી જવાને ‘અદીલહ’ કહેવામાં  
આવે છે. આ દુઆ પઢવાથી ઇન્સાન હકથી ફરી  
જતા અટકે. આમ, દુઆએ અદીલહ એટલે  
હકથી ફરી જતા અટકાવનાર દુઆ અને આ  
દુઆની શર્હ (સમજૂતિ) મૌલાના મીર આગા  
સાહેબ લખનવના મુજતહીદે લખી છે.

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને  
રહીમ છે.

شَهِدَ اللَّهُ أَنَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ

અલ્લાહતઆલાએ પોતા માટે પોતે જ ગવાહી  
આપી કે યકીન કરીને જાણો કે ખુદા સિવાય  
બીજો કોઇ એવો નથી કે જેની ઇબાદત કરી  
શકાય

وَالْمَلَائِكَةُ وَأُولُوا الْعِلْمِ

પણ એજ અલ્લાહ તેમજ મલાએકા અને એ

ઇભવાળા

قَائِبًا بِالْقِسْطِ

કે જેઓ હક અને રાસ્ત ઉપર અદલની સાથે

કાયમ છે

لَا إِلَهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ

પણ તે જ મઅબૂદે બરહક કે જે તમામ ઉપર

સંપૂર્ણ સત્તા ધરાવે છે

إِنَّ الدِّينَ عِنْدَ اللَّهِ الْإِسْلَامُ

બેશક અલ્લાહની પાસે હક દીન ઇસ્લામ છે.

وَأَنَا الْعَبْدُ الضَّعِيفُ الْمَذْنِبُ

હું, અશક્ત, લાચાર, ગુનેહગાર,

الْعَاصِي الْمُحْتَاجُ الْحَقِيرُ

બદકિરદાર, તુચ્છ, મોહતાજ બંદો છું.

أَشْهَدُ لِمُنْعَبِي وَخَالِقِي

હું ગવાહી આપું છું કે નેઅમત આપનાર, પેદા  
કરનાર,

وَرَأَيْتِي وَمُكْرِمِي

રોઝી આપનાર, માનવંતો કરનાર

كَمَا شَهِدَ لِذَاتِهِ

માટે એવી રીતે કે જેવી તેણે પોતાની જાત માટે  
આપી.



وَشَهِدَتْ لَهُ الْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ مِنْ

عِبَادِهِ

અને તેના માટે મલાએકાઓ તથા તેના

બંદાઓમાંના સમજદાર ઇલ્મવાળાઓએ ગવાહી

આપી

بِأَنَّهُ لَا إِلَهَ إِلَّا هُوَ

કે કોઈ માઅબૂદ નથી

ذُو النِّعَمِ وَالإِحْسَانِ وَالكَرَمِ

وَالإِمْتِنَانِ

પણ તે જ, કે જે નેઅમતો આપનાર, એહસાન  
કરનાર, મહેરબાની કરનાર છે.

قَادِرٌ أَرْزِيُّ عَالِمٌ أَبَدِيٌّ

તે એવો છે કે હંમેશથી સત્તાવાન છે. હંમેશાથી  
આલિમ છે,

حَيٌّ أَحَدِيٌّ مَوْجُودٌ سَرْمَدِيٌّ

હંમેશથી મોજૂદ છે અને હંમેશા મોજૂદ રહેશે,

سَبِيحٌ بَصِيْرٌ مُرِيْدٌ كَارِهٌ

સાંભળનાર જોનાર છે, કેટલીક બાબતોનો  
ઈરાદો કરનાર છે, કેટલીક અણગમો રાખનાર  
છે,

مُدْرِكٌ صَدِيْقٌ

તમામ ચીઝનો જાણકાર છે, તવંગર છે.

يَسْتَحِقُّ هَذِهِ الصِّفَاتُ

એ તમામ આ સિફતો તેના માટે લાયક છે

وَهُوَ عَلَىٰ مَا هُوَ عَلَيْهِ فِي عِزِّ صِفَاتِهِ

તેના માટે જે બુઝુર્ગીની સિફતો છે તે જ હાલત  
ઉપર તે છે.

كَانَ قَوِيًّا قَبْلَ وُجُودِ الْقُدْرَةِ وَالْقُوَّةِ

તેની કુદરત અને કુવ્વત જાહેર થવાની પહેલે  
જ સત્તાવાન છે.

وَكَانَ عَلِيمًا قَبْلَ إِجَادِ الْعِلْمِ وَالْعِلَّةِ

ઇલ્મ તથા તેનું કારણ જાહેર કરવાની પહેલેથી  
જ તે આલિમ છે.

لَمْ يَزَلْ سُلْطَانًا إِذْ لَا مَمْلُوكَةَ وَلَا مَالَ

મમલકત અને માલ જાહેર ન હતો ત્યારથી જ  
તે સુલતાન (માલિક) છે.

وَلَمْ يَزَلْ سُبْحَانًا عَلَىٰ جَمِيعِ الْأَحْوَالِ

તમામ અહવાલોમાં હંમેશાથી તે પાક અને  
પાકીઆ છે.

وَجُودُهُ قَبْلَ الْقَبْلِ فِي أَزَلِ الْأَزَالِ وَبَقَاؤُهُ

بَعْدَ الْبَعْدِ مِنْ غَيْرِ انْتِقَالٍ وَلَا زَوَالٍ

પહેલામાં પહેલે તેની જ જાત છે, હંમેશા છે તેનું  
બાકી રહેવું, હદ વિનાનું છે કે તેને ફનાપણું કે  
નાબૂદ થવાપણું નથી.

غَنِيٌّ فِي الْأَوَّلِ وَالْآخِرِ

તે અવ્વલ અને આખર ગની છે.

مُسْتَغْنٍ فِي الْبَاطِنِ وَالظَّاهِرِ

તે જાહેર અને બાતીન છે.

لَا جُورَ فِي قَضِيَّتِهِ

તેના ફેસલામાં ઝુલ્મ નથી,

وَلَا مَيْلَ فِي مَشِيَّتِهِ

તેના ચાહવામાં ન છાજતી બાબત નથી,

وَلَا ظُلْمَ فِي تَقْدِيرِهِ

તેના નિર્માણ કરવામાં ઝુલ્મ નથી,

وَلَا مَهْرَبَ مِنْ حُكُومَتِهِ

तेनी हुक्मतथी भागवानी जग्या नथी,

وَلَا مَلْجَأَ مِنْ سَطَوَاتِهِ

तेना दमामथी कोठ पनाहनी जग्या नथी,

وَلَا مَنَجِيٍّ مِنْ نَقِيبَاتِهِ

तेना कहरथी कोठ जग्या अमाननी नथी.

سَبَقَتْ رَحْمَتُهُ غَضَبَهُ



તેની રહેમત તેના ગઝબ કરતા આગળ છે,

وَلَا يَفُوتُهُ أَحَدٌ إِذَا طَلَبَهُ

તે કોઈને બોલાવે તો તે ગુમ થઈ શકતો નથી

أَزَاحَ الْعِلَلِ فِي التَّكْلِيفِ

તે એવો છે કે પોતાનો હુકમ ઉપાડવામાં  
વાંધાને દૂર કર્યા છે.

وَسَوَى التَّوْفِيقَ بَيْنَ الضَّعِيفِ

وَالشَّرِيفِ مَكَّنَ آدَاءَ الْمَأْمُورِ

તેણે અહકામ બજાવી લાવવા માટે તુચ્છ તેમજ  
આબરુદારને તવફીક તથા શક્તિ સરખી આપી  
છે.

وَسَهَّلَ سَبِيلَ اجْتِنَابِ الْمَحْظُورِ

તેણે હરામથી બચવા માટે આસાન રસ્તા કરી  
આપ્યા છે

لَمْ يُكَلِّفِ الطَّاعَةَ إِلَّا دُونَ الْوُسْعِ

وَالطَّاقَةِ

અને ઇબાદતની તકલીફ દરેકને તેના ગજા  
તથા શક્તિ જેટલી આપી છે.

سُبْحَانَهُ مَا أَبْيَنَ كَرَمَهُ وَأَعْلَى شَأْنَهُ

પાક છે અને તમામ એબથી રહીત છે. તે  
અલ્લાહ બહુ જ રોશન અને પ્રકાશિત છે,

سُبْحَانَهُ مَا أَجَلَ نَيْلَهُ وَأَعْظَمَ إِحْسَانَهُ

પોતાની મહેરબાનીના કારણે અને તેની શાન  
ઘણી જ બલંદ છે. કેવી તેની અઅલા શાન છે  
તે અલ્લાહ પાક છે અને કેવી બક્ષિશ છે અને  
કેવો તેનો મહાન એહસાન છે!

بَعَثَ الْأَنْبِيَاءَ لِيُبَيِّنَ عَدْلَهُ

તેણે પયગમ્બરોને મોકલ્યા કે તેઓ તેની  
અદાલતને જાહેર કરે

وَنَصَبَ الْأَوْصِيَاءَ لِيُظْهِرَ كَوَلَهُ وَفَضْلَهُ

અને ઈમામોને મુકરર કર્યા કે તેઓ ખુદાની  
મહેરબાની અને તેના ફઝલને જાહેર કરે.

وَجَعَلْنَا مِنْ أُمَّةٍ سَيِّدِ الْأَنْبِيَاءِ وَخَيْرِ

الْأَوْلِيَاءِ وَأَفْضَلِ الْأَصْفِيَاءِ وَأَعْلَى

الْأَزْكَيَاءِ مُحَمَّدٍ صَلَّى اللَّهُ عَلَيْهِ وَآلِهِ

وَسَلَّمَ

તેણે અમોને નબીના સરદાર અને અવલીયાથી  
બેહતર અસ્ફેયાથી અફઝલ બહુજ પાક હઝરત

મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની ઉમ્મતમાં  
(પેદા) કર્યા.

أَمَّنَّا بِهِ وَبِأَدْعَانَا إِلَيْهِ وَبِالْقُرْآنِ  
الَّذِي أَنْزَلَهُ عَلَيْهِ

અમો એ હઝરત ઉપર તેમજ જે ચીઝ તરફ એ  
તેઓ બોલાવે છે અને કુરઆન કે તેઓ ઉપર  
નાઝિલ થયું છે એ અને તેની દાઅવત આપે છે

وَبِوَصِيَّهِ الَّذِي نَصَبَهُ يَوْمَ الْغَدِيرِ

ઇમાન લાવ્યા તેમજ તેમના એ વસી કે જેમને  
ગદીરને દિવસે ઇમામ નીમ્યા

وَأَشَارَ بِقَوْلِهِ هَذَا عَلَيَّ إِلَيْهِ"

અને ઇશારો કર્યો કે આ અલી (અ.સ.) છે  
તેમની ઉપર અમો ઇમાન લાવ્યા.

وَأَشْهَدُ أَنَّ الْأَيْمَةَ الْأَبْرَارَ وَالْخُلَفَاءَ

الْأَخْيَارَ بَعْدَ الرَّسُولِ الْمُخْتَارِ

અને હું ગવાહી આપું છું કે જે ઇમામો મહાન  
મરતબાવાળા નેક અને બુઝુર્ગ બહેતરીન  
ખલીફાઓ હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)ની  
બાદ હિદાયત કરનાર છે

عَلِيٌّ قَامِعُ الْكُفَّارِ

કે જેઓમાંના હઝરત અલી (અ.સ.) છે કે જેમણે  
કુફ્રની જડને ઉખેડીને ફેંકી દીધી

وَمِنْ بَعْدِهِ سَيِّدُ أَوْلَادِهِ الْحَسَنُ بْنُ عَلِيٍّ



અને તેમના બાદ તેમની બુઝુર્ગ અવલાદમાં  
હઝરત ઇમામે હસન ઇબ્ને અલી (અ.સ.) છે.

ثُمَّ أَخُوهُ السَّبِطُ التَّابِعُ لِمَرْضَاةِ اللَّهِ

الْحُسَيْنُ

પછી તેમના ભાઈ સિબ્તે રસૂલ હુસયન (અ.સ.)  
છે કે તેઓ અલ્લાહની મરજી ઉપર રાઝી રહેલ  
છે,

ثُمَّ الْعَابِدُ عَلِيُّ ثُمَّ الْبَاقِرُ مُحَمَّدٌ

પછી આબીદ (અ.સ.) છે કે જેમનું નામ અલી  
અ. છે. પછી બાકિર (અ.સ.) છે કે જેમનું નામ  
મોહમ્મદ (અ.સ.) છે.

ثُمَّ الصَّادِقُ جَعْفَرُ ثُمَّ الْكَاسِمُ مُوسَى

પછી સાદિક (અ.સ.) છે જેમનું નામ જઅફર છે,  
પછી કાસિમ (અ.સ.) છે કે જેમનું નામ મૂસા  
(અ.સ.) છે.

ثُمَّ الرِّضَا عَلِيُّ ثُمَّ التَّقِيُّ مُحَمَّدٌ

પછી રઝા (અ.સ.) છે કે જેમનું નામ અલી  
(અ.સ.) છે. પછી તકી (અ.સ.) છે કે જેમનું  
નામ મોહમ્મદ (અ.સ.) છે,

ثُمَّ النَّقِيِّ عَلِيٍّ ثُمَّ الزَّكِيِّ الْعَسْكَرِيِّ  
الْحَسَنِ

પછી નકી (અ.સ.) છે કે જેમનું નામ અલી  
(અ.સ.) છે. પછી ઝકીવ્યુલ અસ્કરી (અ.સ.) છે  
કે જેમનું નામ હસન (અ.સ.) છે.

ثُمَّ الْحُجَّةُ الْخَلْفُ الْقَائِمُ الْمُنْتَظَرُ  
الْمُهْدِيُّ الْمُرْجِيُّ الَّذِي بِبَقَائِهِ بَقِيَتْ  
الدُّنْيَا وَبَيْنِهِ رِزْقُ الْوَرَى

પછી તેમના ફરઝંદ ખુદાની હુજ્જત કાએમ  
(અ.સ.) છે કે જેમનો લકબ મહેદી (અ.સ.) છે.  
એ જનાબ આખર ઝમાનાના માલિક એ છે કે  
તેઓની બરકતથી રોઝી મળે છે અને તેઓના  
બાકી રહેવાથી દુનિયા બાકી છે,

وَبِوَجُودِهِ ثَبَّتَتِ الْأَرْضُ وَالسَّمَاءُ

અને તેમના વજૂદથી જમીન અને આસમાન  
સાબિત છે

وَبِهِ يَمْلَأُ اللَّهُ الْأَرْضَ قِسْطًا وَعَدْلًا بَعْدَ

مَا مَلَأَتْ ظُلْمًا وَجُورًا

અને આએ જમીન ઝુલ્મ અને અત્યાચારથી  
ભરાઈ જશે ત્યારે તેને દૂર કરીને અદલ અને  
ઈન્સાફથી ભરી આપશે.

وَأَشْهَدُ أَنَّ أَقْوَالَهُمْ حُجَّةٌ

અને હું ગવાહી આપું છું કે તેઓના ફરમાન  
હુજ્જત છે

وَأَمْتِثَالَهُمْ فَرِيضَةٌ

અને તેઓની ફરમાબરદારી ફરઝ છે.

وَطَاعَتُهُمْ مَفْرُوضَةٌ

અને તેમની પચરવી વાજિબ છે

وَمَوَدَّتْهُمْ لَازِمَةٌ مَّقْضِيَّةٌ

અને તેમની મોહબ્બત લાઝિમ અને વાજિબ છે

وَإِلْقَادًا بِهِمْ مُنْجِيَّةٌ

અને તેમના ફરમાન મુજબ ચાલવામાં નજાત  
છે

وَمُخَالَفَتَهُمْ مُرْدِيَّةٌ

અને તેમના ફરમાનથી વિરુદ્ધ ચાલવામાં  
હલાકત છે.

وَهُمْ سَادَاتُ أَهْلِ الْجَنَّةِ أَجْمَعِينَ

એ તમામ બુઝુર્ગવારો જન્મતવાળાઓના સરદાર

છે

وَشَفَعَاءُ يَوْمِ الدِّينِ وَأَيُّمَةُ أَهْلِ الْأَرْضِ

عَلَى الْيَقِينِ

અને કયામતને દિવસે શફાઅત કરનારા છે

અને યકીનની રૂએ તેઓ દુનિયાવાળાઓ માટે

ઇમામો છે,



وَأَفْضَلُ الْأَوْصِيَاءِ الْمَرْضِيِّينَ

મહાન બુઝુર્ગ મકબૂલ વસીઓ છે.

وَأَشْهَدُ أَنَّ الْمَوْتَ حَقٌّ

અને હું ગવાહી આપું છું કે ખરેખર મોત હક છે,

وَمُسَاءَلَةَ مَنْكِرٍ وَنَكِيرٍ فِي الْقَبْرِ حَقٌّ

અને કબરમાં મુનકીર અને નકીરના સવાલ હક છે,

وَالْبُعْثَ حَقُّ

અને કબરમાંથી ઉઠવું હક છે,

وَالنُّشُورَ حَقُّ

અને નશ્ર હક છે

وَالصِّرَاطَ حَقُّ وَالْبِيْزَانَ حَقُّ

ત્રાજવું (મીઝાન) હક છે અને પુલે સેરાત હક  
છે,

وَالْحِسَابَ حَقٌّ وَالْكِتَابَ حَقٌّ

અને હિસાબ હક છે, અને કિતાબ હક છે

وَالْجَنَّةَ حَقٌّ وَالنَّارَ حَقٌّ

અને અને જન્નત હક છે અને જહન્નમ હક છે.

وَأَنَّ السَّاعَةَ آتِيَةٌ لَا رَيْبَ فِيهَا

અને ખરેખર કયામતનો દિવસ આવનાર છે,

وَأَنَّ اللَّهَ يَبْعَثُ مَنْ فِي الْقُبُورِ

તેમાં લેશમાત્ર પણ શક નથી. અને ખરેખર  
અલ્લાહ તઆલા તે દિવસે કબરોમાં સર્વેને  
ઉઠાડશે.

اللَّهُمَّ فَضْلُكَ رَجَائِي وَكَرَمُكَ وَرَحْمَتُكَ  
أَمَلِي

અથ અલ્લાહ હું તારા ફઝલ અને મહેરબાની  
અને રહેમતનો અને માફીનો ઉમેદવાર છું.

لَا عَمَلَ لِي أَسْتَحِقُّ بِهِ الْجَنَّةَ

મારો એવો કશો હક નથી કે જેના થકી હું  
જન્મતનો હકદાર થાઉં

وَلَا طَاعَةَ لِيُ اسْتَوْجِبُ بِهَا الرِّضْوَانَ

તેમજ મારી કરેલી ઇબાદત એવી નથી કે જેને  
તું પસંદ કરે અને રાઝી થાય

إِلَّا أَنِّي اعْتَقَدْتُ تَوْحِيدَكَ وَعَدْلَكَ

પણ એટલું જ કે તારી વહદાનીયત અને તારા  
અદલનો એતેકાદ રાખું છું

وَأَرْتَجَيْتُ إِحْسَانَكَ وَفَضْلَكَ

તેથી તારા એહસાન અને ફઝલનો ઉમેદવાર

હું.

وَتَشَفَّعْتُ إِلَيْكَ بِالنَّبِيِّ وَالِإِلهِ مِنْ أَحِبَّتِكَ

وَأَنْتَ أَكْرَمُ الْأَكْرَمِينَ وَأَرْحَمُ

الرَّاحِمِينَ

અને હું શફાઅત અને સિફારીશ કરવાવાળા

તારી દરગાહમાં હઝરત રસૂલ (સ.અ.વ.)ને

અને તેમની આલને અને તેમના વસીયોને  
ઠેરાવું છું કે જેઓ તારા મોહિબ છે, ખરેખર તું  
મહેરબાની કરવાવાળાઓમાં શ્રેષ્ઠ, મહેરબાની  
કરનાર અને રહેમ કરવાવાળાઓમાં ઉત્તમ  
રહેમ કરનાર છો.

وَصَلَّى اللهُ عَلَى نَبِيِّنَا مُحَمَّدٍ وَآلِهِ أَجْمَعِينَ  
الطَّيِّبِينَ الطَّاهِرِينَ وَسَلَّمَ تَسْلِيمًا  
كَثِيرًا كَثِيرًا أَوْ لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللَّهِ  
الْعَلِيِّ الْعَظِيمِ

અમારા નબી મોહમ્મદ (સ.અ.વ.) તથા તેમની  
પાક પાકીઝા આલ પર રહેમત નાઝિલ થાય  
અને સલામ થાય તેઓ પર વધારેમાં વધારે  
બુલંદ અને મહાન મરતબાવાળા અલ્લાહ  
સિવાય કોઈ કુવ્વત અને તાકત ધરાવતો નથી.

اللَّهُمَّ يَا أَرْحَمَ الرَّاحِمِينَ

અથ મારા માઅબુદ રહેમ કરવાવાળાઓમાં  
સૌથી વધારે રહેમ કરનાર

إِنِّي أَوْدَعْتُكَ يَقِينِي هَذَا وَثَبَاتٍ دِينِي



અય અલ્લાહ હું મારા આ એઅતેકાદને તને  
સોપું છું તેમજ હું દીન ઉપર કાયેમ રહું તે પણ  
તારે હવાલે કરું છું

وَأَنْتَ خَيْرٌ مُسْتَوْدِعٍ

અને તું શ્રેષ્ઠ અમાનતદાર છે

وَقَدْ أَمَرْتَنَا بِحِفْظِ الْوَدَائِعِ

અને ખરેખર તેં અમોને અમાનતો સાચવવાનો  
અને તે પાછી આપવાનો હુકમ ફરમાવેલ છે

فَرُدَّهُ عَلَيَّ وَقْتَ حُضُورِ مَوْتِي

माटे मारा मरण वખते ते मारी अमानत  
पाछी सोंपी आपजे.

بِرَحْمَتِكَ يَا أَرْحَمَ الرَّاحِمِينَ

तने वास्तो आपुं छुं तारी रहेमतनो अथ रहेम  
करवावाणाओमां श्रेष्ठ रहेम करनार

اللَّهُمَّ إِنِّي أَعُوذُ بِكَ مِنَ الْعَدِيلَةِ عِنْدَ

الْمَوْتِ

અય અલ્લાહ! મૌતના સમયે હકથી બાતીલ  
તરફ ફરી જવાથી તારી પનાહ ચાહું છું.

તે માટે કે એહતેઝાર (રૂહ  
નીકળવા)ના સમયે શૈતાન હાજર થઈને  
વસવસો અને શક પૈદા કરવા ચાહે છે કે  
જેથી ઇન્સાન તે દુનિયામાં ઇમાન વગર  
ચાલ્યો જાય. આ જ કારણ છે કે  
દુઆઓમાં આ મૌકા ઉપર ખુદાની  
પનાહ માંગવાનો હુકમ આપવામાં  
આવ્યો છે.

જનાબ ફખરુલ મોહકકેકીન

ફરમાવે છે કે જે કોઈ શખ્સ યાહે કે તે  
દુનિયામાંથી સાચા અકીદા સાથે જાય.  
તેને જોઈએ કે ઇસ્લામના બુનિયાદી  
અકીદાઓને યકીની દલીલો અને પાક  
દિલની સાથે ધ્યાનમાં લે. પછી તેને  
પરવરદિગારના હવાલે કરી દે. પછી  
નીચે મુજબ કહે :

اللَّهُمَّ يَا أَرْحَمَ الرَّاحِمِينَ

અથ અરહમર રાહેમીન!

إِنِّي أُوَدِّعُكَ يَقِينِي هَذَا وَثَبَاتَ دِينِي

وَأَنْتَ خَيْرُ مُسْتَوْدِعٍ

મેં મારા યકીનને અને મારા દીનદારીના  
સબૂતોને તારી પાસે અમાનત તરીકે રખાવી  
દીધા. તું બહેતરીન અમીન છે

وَقَدْ أَمَرْتَنَا بِحِفْظِ الْوَدَائِعِ فَرُدَّهُ عَلَيَّ

وَقْتُ حُضُورِ مَوْتِي

અને તે અમાનતોને પરત આપવાનો હુકમ  
આપ્યો છે. માટે મૌતના સમયે મારી આ  
અમાનતને પરત આપજે.